

## પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભો

પ્રો.એસ.જે.બ્રિયેટી, વેફાનિક (સસ્ય વિજ્ઞાન), પ્રો. ભક્તિ બી. પંચાલ, વેફાનિક (બાગાયત) ડૉ. આર. કે. પટેલ વેફાનિક (પાક સંરક્ષણ) અને ડૉ.જેએચ.રાઠોડ, વરિષ્ઠ વેફાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત

### ઓષ્ણા વ્યવસ્થા :

#### જીવામૃત

##### બનાવવાની પદ્ધતિ:

૧૮૦ લીટર પાણી +  
૧૦ લીટર ગૌમુહ +  
૧૦ કી.ગ્રા. તાજુ દેશી ગાયનું ગોબર +  
૫૦૦ ગ્રામ મુઠી વડ નીચેની માટી/શોટા-પાળાની માટી/રાફડાની માટી

૨ કી.ગ્રા. દેશી ગોળ +  
૨ કી.ગ્રા. ચણાનો લોટ

- આ મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ ફુલ ર વખત ૧-૨ મિનિટ માટે ૭ દિવસ સુધી હલાવવું પછી કરવો.

##### કચાં પાકમાં આપી શકાય:

કોઈપણ પ્રકારની ધાન્ય, કઠોળ, બાગાયતી, ઔષધિય કે અન્ય કોઈપણ વર્ગના પાકને આપી શકાય.

##### આપવાની રીત:

નીચેની શ્રેણીમાંથી કોઈપણ

- (૧) પિયત (સિંચાઈ) ના પાણી સાથે
- (૨) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું જમીન ઉપર
- (૩) ઉભા પાક પર છંટકાવ કરીને

##### પ્રમાણ:

પ્રતિ એકર ૨૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહીનામાં ૧ થી ૨ વખત ઉપરોક્ત ત્રણ પૈકી કોઈપણ રીત દ્વારા પાકને આપવું.

##### ફાયદા:

- ◆ જીવામૃત જમીનમાં આપવાથી જીવાણું સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે.
- ◆ જીવામૃત સુષ્પુત્ર (સમાધિમાં) રહેલા અળસીયાને જગાડીને કામે લગાવે છે.

##### નોંધ:

- (૧) જીવામૃત માટે કુવારા પદ્ધતિ સૌથી ઉત્તમ છે, કારણ કે કુવારાના પાણી દ્વારા જીવામૃતનો છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભરી જાય છે.
- (૨) જ્યારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામ-ત બપોરના બદલે સવારે કે સાંજે આપવું.
- (૩) જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્યપ્રકાશ કે હંડી કે વરસાદનું ન પડવું જોઈએ.
- (૪) સાત દિવસ સડયા બાદ ૧૫ દિવસ સુધી વાપરી શકાય.

## ધન જીવામૃત

### બનાવવાની પદ્ધતિ

#### પ્રથમ રીત:

- ૨૦ કી.ગ્રા.૧૦% તાપમાન સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું ગોબર લઈ તેમને ફેલાવવું.
- તેના ઉપર છાણથી જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે બેળવવું.
- આ મિશ્રણને ૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતડા સ્તરમાં સુકવવું.
- આ સ્તરને દિવસમાં બે-એણ વખત ઉપર નીચે કરવું.
- સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુકો કરવો.
- ત્યારબાદ શાણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.

#### દીજી રીત:

૧૦૦ કિગ્રા. ગાયનું તાજું ગોબર +

૨ લીટર જીવામૃત +

૧ કીગ્રા. દેશી ગોળ +

૧ કીગ્રા. ચણાનો લોટ

- આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું.
- મિશ્રણ સુકાય બાંગડાનો ભુકો કરવો.
- પ્રથમ રીત મુજબ સંગ્રહ કરવો.

#### દીજી રીત:

- ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગાડા (સ્લરી)ને તડકામાં સુકવવો.

- ૫૦ કીગ્રા. રગાડો (સ્લરી) પાવડરના રૂપમાં + ૫૦ કીગ્રા. દેશી ગાયનું ગોબર + ૧ કીગ્રા. દેશી ગોળ + ૧ કીગ્રા. ચણાનો લોટ + ૨ લીટર જીવામૃત.
- આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર - નીચે ફેરવવું.
- સંપૂર્ણ સુકાય બાદ ગાંગડાનો ભુકો કરવો.
- જરૂરીયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો.

#### કચારે અને કેવી રીતે આપી શકાય:

- જમીનની અંતિમ ખેડ પછી કે પહેલાં પ્રતિ એકર ૨૦૦ કીગ્રા. મુજબ આપવું.
- રાસાયણિક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય.
- કુલની અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કીગ્રા. આપવું.

#### નોંધ:

- વધુ પડતી હંડી હોય તો સંગ્રહ કરતી વખતે કોથળાથી ટાંકવું.

- વધુ પડતો સૂર્ય પ્રકાશ કે હંડી વરસાદનું પાણી ન પડવું જોઈએ.

- એણે પ્રકારના ધન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે.

- તેનાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે.

## બીજ/રોપ માવજત :

### બીજમૃત:

#### બનાવવાની પદ્ધતિ:

- ૧૦૦ કીગ્રા બિયારણને પટ આપવા માટે -  
20 લીટર પાણી (વધુમાં વધુ)+  
૫ લીટર ગૌમુખ+  
૫ કીગ્રા ગાયનું તાજું ગોબર +  
૫૦ ગ્રામ ચૂનો +  
૧ મુઠી વડ નીરેની માટી/શોટા-પાળાની માટી/રાફડાની માટી
- આ મિશ્રણને કોથળાથી ટાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.

**વાવણી પહેલા બિયારણને બીજમૃતનો પટ આપવાની રીત:**

- **મગફિલી અને સાથોળીન માટે:**  
આ બંને પાકની બહારની ફોટરી ખૂબ જ નરમ છોવાથી તેના બીજને પટ આપતી બખતે બીજમૃત ને બદલે ધન જીવામૃતનો ઉપયોગ ૧૦:૧ના પ્રમાણમાં કરવો એટેલે કે ૧૦ કીગ્રા બિયારણ હોય તો ૧ કીગ્રા ધન જીવામૃત બેળવવું.
- **ધાન્ય અને તેલિબીયા પાકો માટે:**  
ચોમા, બાજરા, મકાઈ, જુવાર, દાંત, તલ, અડસી, સૂર્યમુખી, કપાસ, કંસુલી વેગેર પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજમૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાયાદામાં સુકવવું.
- **કંદળ વર્ગના પાક માટે:**  
મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજમૃતનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઊફર નીચે કરવું અને તડકા પાસેના છાયાદામાં સુકવવું.
- **કંદમૂળ માટે:**  
બરાકા, હળદર, આદુ, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજમૃતમાં થોડી સેકન્ડ માટે દુબાડીને કાઢ્યા બાદ વાવવું.
- **શાકભાજુ માટે:**  
બહારથી લીધેલા શાકભાજુના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજમૃતમાં દુબાડીને વાવવું જેથી કંપનીનો પટ ધોવાઈ જાય.
- **રોપા માટે:**  
રોપાના મૂળ બીજમૃતમાં અમુક સેકન્ડ માટે દુબાડીને પછી વાવવાં.

### રોગ-જીવાત નિયંત્રણ માટેની દવાઓ

### નીમાસ્ત્ર

#### બનાવવાની પદ્ધતિ:

- ૧૮૦ લીટર પાણી + ૧૦ લીટર ગૌમુખ + ૨ કીગ્રા તાજું ગોબર + ૧૦ કીગ્રા કડવો લીમડો.
- આ મિશ્રણને કોથળાથી ટાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર - સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

### છંટકાવ:

પ્રતિ એકર ૨૦૦ લીટર ફક્ત નીમાસ્ત્ર, પાણી બેળવવાનું નથી.

### સંગ્રહણ ક્ષમતા:

૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

### નિયંત્રણ:

ચૂસીયા જીવાતો, સફેદ માખી, નાની ઈયળ

### બ્રહ્માસ્ત્ર

#### બનાવવાની પદ્ધતિ:

- ૨૦ લીટર ગૌમુખ + ૨ કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૨ કીગ્રા કર્દેજના પાનની ચટણી + ૨ કીગ્રા સીતાફળના પાનની ચટણી + ૨ કીગ્રા એરેંડાના પાનની ચટણી + ૨ કીગ્રા ધતુરાના પાનની ચટણી
- આ મિશ્રણને ટાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરવું પછી હંકુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

### છંટકાવ:

પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહ્માસ્ત્ર

### સંગ્રહણ ક્ષમતા:

૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

### નિયંત્રણ:

મોટી ઈયળ, ચૂસીયા જીવાતો

### અભિનશાસ્ત્ર

#### બનાવવાની પદ્ધતિ:

- ૨૦ લીટર ગૌમુખ + ૨ કીગ્રા કડવા લીમડાના પાનની ચટણી + ૫૦૦ ગ્રામ તીખી મરચીની ચટણી + ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી + ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી
- આ મિશ્રણને ટાંકી ધીમા તાપે એક ઉભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી હંકુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

### છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી ૬ થી ૮ અભિનશાસ્ત્ર

### સંગ્રહણ ક્ષમતા : ૩ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

**નિયંત્રણ:** બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકારને કોરનાર ઈયળ, ફળોમાં થતી ઈયળ, કળીઓમાં રહેલી ઈયળ, કપાસના કાચા છુંડવામાં થતી ઈયળ અને અન્ય તમામ નાની મોટી ઈયળોને કાબુમાં રાખે છે.

### દશપણી અર્ક:

#### બનાવવાની પદ્ધતિ:

- ૧૮૦ લીટરપાણી + ૨૦ લીટર ગૌમુખ + ૨ કીગ્રા છાણા +
- આ મિશ્રણ લાકડીથી હલાવીને ૨ કલાક છાયામાં કોથળાથી ટાંકવું જેથી જૈવ-રાસાયણિક બંધ તુટી જાય ત્યારબાદ ઉપરોક્ત મિશ્રણ +
- ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર + ૫૦૦ ગ્રામ આદુની ચટણી + ૧૦ ગ્રામ હીંગનો પાવડર +
- આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ટાકવું.

બીજા દિવસે સવારે:

ઉપરોક્ત મિશ્રણ +

- ૧ કીગ્રા તીખી મરચાની ચટણી + ૫૦૦ ગ્રામ દેશી લસણાની ચટણી + ૧ કીગ્રા તમાકુનો પાવડર. આ મિશ્રણને ટાંકીને વરસાદ અને તડકાથી દૂર છાયામાં રાખવું.

ત્રીજા દિવસે સવારે:

ઉપરોક્ત મિશ્રણ +

- ૨ કીગ્રા કવા લીમડાની ડાળીઓ, પાન + ૨ કીગ્રા કરંજના પાન + ૨ કીગ્રા એરંડાના પાન + ૨ કીગ્રા સીતાફળ / રામફળના પાન + ૨ કીગ્રા ધતુરાના પાન + ૨ કીગ્રા બિલ્લિ પત્ર + ૨ કીગ્રા નગોડના પાન + ૨ કીગ્રા તુલસીની ડાળી, પાન + ૨ કીગ્રા ગલગોડાના કુલ, છોડ, પાન + ૨ કીગ્રા કડવા કારેલાના પાન + ૨ કીગ્રા પષેયાના પાન + ૨ કીગ્રા આકડાના પાન + ૨ કીગ્રા કરંજના પાન + ૨ કીગ્રા અંબાના પાન + ૨ કીગ્રા જામફળના પાન + ૨ કીગ્રા હળદર પાન + ૨ કીગ્રા આદુના પાન + ૨ કીગ્રા કરેણના પાન + ૨ કીગ્રા દેશી/રામ બાવળના પાન + ૨ કીગ્રા બોરડીના પાન + ૨ કીગ્રા કુવાડીયાના પાન + ૨ કીગ્રા જાસુદના પાન ૨ કીગ્રા સરગવાના પાન

છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર દશપરણી અર્ક

સંગ્રહણ ક્ષમતા: ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

નિયંત્રણ: બધા જ પ્રકારની જીવાતો માટે, ઈયાળો, શ્રાસ.

### સાપ્ત ધાન્યાંકુર અર્ક

બનાવવાની પદ્ધતિ:

- ૧૦૦ ગ્રામ તલ એક વાટકામાં લઈ, તલ કુલે તેટલું પાણી નાખવું + ૧૦૦ ગ્રામ મગાના દાણા + ૧૦૦ ગ્રામ અડદના દાણા + ૧૦૦ ગ્રામ ચોળીના દાણા + ૧૦૦ ગ્રામ મઠના દાણા + ૧૦૦ ગ્રામ દેશી ચણાના દાણા + ૧૦૦ ગ્રામ ઘણિના દાણા
- આ મિશ્રણ પાણીમાં ડુબી જાય તેટલું પાણી નાખવું.
- બીજા દિવસે સાતેય ધાન્યને પાણીમાંથી કાઢી નાખવા પછી તેને સ્વચ્છ કપડામાં અંકુરીત થવા માટે લટકાવી દેવા અને પાણી ને સાચવવું.
- ૧ સેમી લંબાઈનો અંકર થાય ત્યારે તેને બહાર કાડી ચટણી બનાવવી.

ત્યારબાદ

- ૨૦૦ લીટર પાણી + ૧૦ લીટર ગૌમુશ + ધાન્યનું પાણી + ધાન્યની ચટણી
- આ મિશ્રણ બરાબર ભિક્સ થઈ જાય ત્યાં સુધી લાકડાના હાથા વડે હલાવ્યા બાદ કોથળાથી ટાંકીને ૨ કલાક રાખવું કપડાંથી ગાળવું અને ૪૮ કલાકમાં છંટકાવ કરવો.

છંટકાવ : ૪૮ કલાકમાં છંટકાવ કરવો.

સંગ્રહણ ક્ષમતા : ૪૮ કલાક સુધી ઉપયોગમાં લઈ શકાય.



: પ્રકારાક :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ. સુરત



## પ્રાકૃતિક કૃષિના આધાર સ્તરંભો

### કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી

સુરત - ૩૬૫૦૦૭

ફોન નં. (૦૨૬૧) ૨૫૫૫૫૫૫૫

પ્રકાશન નં. ન.કૃ.યુ./૦૪/૦૫/૦૮૯/૨૦૨૨-૨૩

વર્ષ : ૨૦૨૨- ૨૦૨૩